



SEPL/SE/Aug/22-23
August 08, 2022

**The General Manager,
Corporate Relations/Listing
Department
BSE Limited**
Floor 25, P.J. Towers,
Dalal Street,
Mumbai – 400 001
Scrip Code : 501423

**The Manager,
Listing Department
National Stock Exchange of India Limited**
Exchange Plaza, Plot No. C/1, G Block,
Bandra – Kurla Complex,
Bandra (E),
Mumbai – 400 051
Scrip Code : SHAILY

Sub : Newspaper advertisement titled “Public Notice of 42nd Annual General Meeting of the Company to be conducted through VC/OAVM”

Ref : Regulation 30 of the SEBI (Listing Obligations and Disclosure Requirements) Regulations, 2015

Dear Sir/Madam,

Please find enclosed copies of the newspaper advertisement titled “**Notice of the 42nd Annual General Meeting, Remote E-Voting information, and Book closure**” that appeared in 6th August 2022 edition of Business Standard, Ahmedabad (English) and Vadodara Samachar, Vadodara (Gujarati).

Kindly take the same on record.

Thanking You.

Yours truly,

For Shaily Engineering Plastics Limited

Preeti Sheth
Asst. Company Secretary
ACS36624

Encl : Newspaper clippings (English and Gujarati)

E-AUCTION SALE NOTICE
M/s DOSHION WATER SOLUTION PRIVATE LIMITED (IN LIQUIDATION)
 Office No. 3, 2nd Floor, A Wing, Godrej Coliseum, Eastern Express Hwy, B/H Everard Nagar, Sion, West Mumbai, Mumbai, Maharashtra- 400022.
 CIN No. U41000MH2007PT173486
Liquidator: CA Vikash Gautamchand Jain
 Liquidator Address: 204, Wall Street I, Near Gujarat College Ellisbridge, Ahmedabad Gujarat-380006. Email: cirp.doshion@gmail.com Contact No. +91 7990672640

E-Auction
 Sale of Assets under Insolvency and Bankruptcy Code, 2016
Date and Time of Auction: 26.08.2022 from 3.00 p.m. to 5.00 p.m.
 (With unlimited extension of 5 minutes each)
Last Date for depositing EMD: 23.08.2022

Sale of Assets and Properties owned by M/s Doshion Water Solution Private Limited (In Liquidation) forming part of Liquidation Estate of M/s Doshion Water Solution Private Limited (In Liquidation) in possession of the Liquidator, appointed by the Hon'ble National Company Law Tribunal, Mumbai vide order dated 20.09.2021. The sale of properties will be done by the undersigned through the e-auction platform <https://ncltauction.auctiontiger.net> (Amount in Rs.)

Asset	Reserve Price	EMD	Incremental Value
Lot 1: Details of property A. Industrial Land and Building located at Plot No. 24.25.28, GIDC Vatva Industrial Estate, Phase-II, Opposite Nicheim Industries, Vatva, Ahmedabad. (Land Area - 10,358 sq. mtrs) B. Plant and Machinery of Vatva Plant C. Inventory of Vatva	24,75,00,000	1,00,00,000	10,00,000

Terms and Condition of the E-auction are as under:

- E-Auction will be conducted on "AS IS WHERE IS", "AS IS WHAT IS" and "WHATEVER THERE IS" basis through approved service provider M/s E-Procurement Technologies Limited (Auction Tiger).
- The Complete E-Auction process document containing details of the Assets, Assets wise bifurcation of reserve price is given, online e-auction Bid Form, Declaration and Undertaking Form, General Terms and Conditions of online auction sale are available on website <https://ncltauction.auctiontiger.net>.
- Contact: For Technical support-Mr Praveen Kumar Thevar at +91-9722778828 / 079 6813 6855/854/800
 E-mail: praveen.thevar@auctiontiger.net, nclt@auctiontiger.net, support@auctiontiger.net OR
 For Auction Process CA Vikash Jain at +91 7990672640
 E-mail ID: cirp.doshion@gmail.com

Sd/-
 CA Vikash Gautamchand Jain
 Liquidator
 IBI/PA-001/IP-P00354/2017-2018/10612

PUBLIC NOTICE
 That our Client (1) Manjuben Samtabhai Rathwa (2) Samtabhai Laxmanbhai Rathwa has demanded for the title clearance Certificate of their jointly owned Property situated at Mouje: Chhotadepur, on land bearing C.S. No. 1912, Sheet no. 27, Chalta No. 1, Satta Prakar A, total land admeasuring 266629.51 Sq. Mtrs., known as 'Gurukrupa Society', Paikki land known as "YANKARVAS KOTAR" bearing C.S. no. 1912/117, Hissa no. 7, Sheet No. 28 to 30, 35 total land admeasuring 56964.51 Sq. Mtrs., Paikki plot no. 103, Plot admeasuring 92.98 Sq. Mtrs., at Registration Sub District and District Chhotadepur. That the said Property was previously owned by Nirmalben Dayalbai Patel, through Sale Deed vide Registration No. 490, dated 08.10.2014, wherein the said Original Sale Deed along with its Registration Receipts is found to be missing. Therefore if any individual, Bank, Society, Institution / Financial Institution, Governmental / Semi Governmental, has its rights, charge, encumbrances, or lien by any means; on the said property, then within 07 days from the publication of the notice may send their objections along with the Supportive Evidence. If not sent within given period of time, then my client will initiate further proceedings.
Date - 06-08-2022. Under the instruction form the client.
SAPAN TEREDesai (ADVOCATE)
 Office: 407, 4th Floor, Bluechip Complex, B/s. Vadodara Stock Exchange, Sayajigunj, Vadodara. (M) 9426306324

CHANGE OF NAME
 I have changed my name from **KHUSHUBEN KAMLESH HEMANI** to new name **KHUSHBU NARENDRABHAI PARMAR**
 Address : 308, Floor-3, Heaven Home, Nr.ESIC Hospital, 500 Gtr, GIDC, Ankleshwar.

CHANGE OF NAME
 I HAVE CHANGE MY OLD NAME FROM **PANCHAL DAXESH MAFATLAL TO NEW NAME PANCHAL DAXESHKUMAR MAFATLAL & I WILL BE KNOWN AS NEW NAME WHICH PLEASE NOTE.**
 SD-PANCHAL DAXESHKUMAR MAFATLAL
 ADD:- B-81, NANDANVAN ROW HOUSE, JHANGIRPURA, SURAT-395005

पंजाब नैशनल बैंक Punjab National Bank
 Circle Sastra, Stock Exchange Building, Ground Floor, Fortune Tower, Sayajiganj, Vadodara (Gujarat) - 390005. Email: cs8330@pnb.co.in

[Refer Rule 8 (1)] **POSSESSION NOTICE (FOR IMMOVABLE PROPERTIES)**
 Where, The undersigned being the Authorised Officer of Punjab National Bank, Circle SASTRA Vadodara under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of the powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued demand notice dated 20.05.2022 under section 13(2) of the said Act calling upon the Borrower **Mr. Prafulsinh Ranjitsinh Gohil (Borrower) and Mr. Rahman Abdul Motiyanrahman (Guarantor)** to repay the amount mentioned in the notice **Rs. 10,69,609/- (Rupees Ten Lakh Sixty Nine Thousand Six Hundred Nine only) as on 30.04.2022** plus further interest wef., 01/05/2022 and cost expenses etc., until payment in full within 60 days from the date of the receipt of the said notice.
 The borrowers having failed to repay the amount, notice is hereby given to the borrowers and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of power conferred on him under section 13(4) of the said Act read with Rule 8 of the said Rules on **30.07.2022**.
 The borrowers in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the Punjab National Bank for an amount of **Rs. 10,52,297/- (Rupees Ten Lakh Fifty Two Thousand Two Hundred Ninety Seven only) as on 30/06/2022** and interest thereon and expenses etc., unless payment in full.
 The borrowers/guarantor's/mortgagor's attention is invited to provision of Sub Section (8) of the Section 13 of the Act in respect of time available to redeem the secured assets.

DESCRIPTION OF THE IMMOVABLE PROPERTY
 Residential Flat No. 282/283, 2nd Floor, Super built-up area of flat 64.00 Sq.Mtrs, Land bearing R.S. No. 257 Paiki Shree Hari Township, Ajwa Road, Opp. Pancham Party Plot, Vadodara, Gujarat-390014, Property owner name Mr. Prafulsinh Ranjitsinh Gohil. **Boundaries:** East: Flat No. 281, North: Ajwa Main Road, South: Shree Hari Township Tenements, West: Flat No. 284.

Date: 30.07.2022 - Place: Vadodara Authorised Officer - Punjab National Bank

Shaily Engineering Plastics Limited **SHAILY**
 Engineering Plastics Ltd
CIN : L51900GJ1980PLC065554
Regd. Office : Survey # 364/366, Post : Rania - 391 780, Taluka : Savli, Dist. Vadodara.
Phone No. : 02667 - 244307/ 361 | **Fax No. :** 02667-244372
E-mail : investors@shaily.com | **Visit us :** www.shaily.com

NOTICE OF 42nd ANNUAL GENERAL MEETING, REMOTE E-VOTING INSTALLATION AND BOOK CLOSURE

Notice is hereby given that :

- The 42nd Annual General Meeting of Members of the Company will be held on **Saturday, 27 August 2022, at 11:00 a.m., IST** through Video Conferencing (VC) / Other Audio Visual Means (OAVM). In compliance with General Circular numbers 20/2020, 14/2020, 17/2020, 02/2021, 02/2022 issued by the Ministry of Corporate Affairs (MCA) read with Circular number SEBI/HO/CFD/CMD1/CIR/P/2020/79 and SEBI/HO/CFD/CMD2/CIR/P/2021/11 issued by the Securities and Exchange Board of India (SEBI) (hereinafter collectively referred to as "Circulars"), Companies are allowed to hold AGMs through VC, without the physical presence of members at a common venue. Hence, the AGM of the Company is being held through VC to transact the business as set forth in the Notice of the AGM dated May 30, 2022.
- In compliance with the Circulars, electronic copies of the Notice of the AGM and Annual Report 2021-22 have been sent to all the members whose email IDs are registered with the Company / Depository Participant(s). The same are also available on the website of the Company at www.shaily.com/investors/annual-report, website of BSE Limited www.bseindia.com, NSE Limited www.nseindia.com and on National Securities Depository Limited ("NSDL") at www.evoting.nsdl.com. The dispatch of notice of AGM has been completed on August 04, 2022.
- Members holding shares either in physical form or dematerialized form, as on the cut-off date, Saturday, August 20, 2022, may cast their vote electronically on the business as set forth in the Notice of the AGM through electronic voting system of NSDL ("remote e-voting").

Members are hereby informed that :

- The business as set forth in the Notice of the AGM may be transacted through remote e-voting or e-voting system at the AGM.
- The remote e-voting shall commence on **Wednesday, August 24, 2022 at 9:00 a.m., IST;**
- The remote e-voting shall end on **Friday, August 26, 2022 at 5:00 p.m., IST;**
- The cut-off date for determining the eligibility to vote by remote e-voting or by e-voting system at the AGM shall be **Saturday, August 20, 2022;**
- Remote e-voting module will be disabled after 5:00 p.m., IST on Friday, August 26, 2022.
- Any person, who acquires shares of the Company and becomes a member of the Company after dispatch of Notice of the AGM and holds shares as of the cut-off date i.e. August 20, 2022, may obtain the login ID and password by sending a request at evoting@nsdl.co.in. However, if a person is already registered with NSDL for e-voting, then existing user ID and password can be used for casting vote;
- Members may note that; (a) the remote e-voting module shall be disabled by NSDL beyond 5:00 p.m., IST on August 26, 2022 and once the vote on a resolutions is cast by the member, the member shall not be allowed to change it subsequently; (b) the facility for voting will also be made available during the AGM and those members present in the AGM through VC facility who have not cast their vote on the resolutions through remote e-voting and otherwise not barred from doing so, shall be eligible to vote through the e-voting system at the AGM; (c) the members who have cast their vote by remote e-voting prior to the AGM may also attend the AGM but shall not be entitled to cast their vote again; and (d) Only those persons whose name is recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date shall be entitled to avail the facility of remote e-voting or e-voting at the AGM.
- The manner of voting remotely for members holding shares in dematerialized mode, physical mode and for members who have not registered their email addresses is provided in the Notice of the AGM. The details will also be made available on the website of the Company. Members are requested to visit www.shaily.com to obtain such details.
- Members who have not registered their email addresses are requested to register their email addresses with respective depository participant(s) and members holding shares in physical mode are requested to update their email addresses with Company's Registrar & Share Transfer Agent, M/s Bigshare Services Private Limited at www.bigshareonline.com/investorRegistration.aspx to receive copies of the Annual Report 2021-22 alongwith the Notice of the 42nd AGM, instructions of the remote e-voting and instructions for participation in the AGM through VC.
- In case of queries relating to remote e-voting or need technical assistance during the AGM, members may refer to the Frequently Asked Questions (FAQs) for members and e-voting user manual for members at the 'Downloads' section of NSDL's website or call the toll free no. 1800-222-990 or send a request at evoting@nsdl.co.in or contact NSDL officials Ms. Sarita Mote on Toll free no.: 1800 1020 990 and 1800 22 44 30 or send a request at evoting@nsdl.co.in.
- The Register of Members and the Share Transfer books of the Company will remain closed from Saturday, August 20, 2022, to Saturday, August 27, 2022 (both days inclusive) for the purpose of AGM.

By Order of the Board
 For Shaily Engineering Plastics Limited
 Sd/-
 Preeti Sheth
 Company Secretary

Vadodara
 August 05, 2022

Bank of Baroda
 Pal Branch, Royal Platinum, Shop no. 4-7 Palanpuram, Canal Road, Surat – 395009, Ph. : 0261-277734/35, Mo.: 8980026753, Email :- surpal@bankofbaroda.com

POSSESSION NOTICE (Symbolic) (immovable Property)
 Whereas, The undersigned being the authorized officer of the BANK OF BARODA under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (54 of 2002) and in exercise of powers conferred under Section 13(12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice calling upon the Borrowers to repay the amount mentioned in the notice being the amount with further interest and cost etc. within 60 days from the date of receipt of the said notice.
 The Borrower having failed to repay the amount, notice is hereby given to the borrower and the public in general that the undersigned has taken **Symbolic Possession** of the property described herein below in exercise of powers conferred on him under Sub Section (4) of section 13 of the Act read with rule 8 of Security Interest (Enforcement) Rules 2002, on the **2nd day of August of the year 2022**.
 The Borrower in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the **Bank of Baroda, Pal Branch, Surat**.
 The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

Sr. No.	Borrower's Name	Demand Notice Date & Amount(Rs.)	Description of the Property
1.	Mr. Rajendra Sitaram Patil (Borrower)	21/03/2022 Rs. 10,05,827.90 plus interest other charges	Residential property situated at Village - Tundi, Taluka - Palsana Dist- Surat, plot no 58, Type- A, Shri Krishna Residency, Block No.327 (Block No s 327+329), R.S.No.306/2, 309/2, 314/2, 315/P, 316, 309/1A, 312/2, 315/P & 314/1, Total area - 92.09 sq.mtrs. Bounded : On the North : Plot no 8-57, On the South : Plot no A-59, On the East : after Boundary Plot no. A.45, On the West: 6.00 Meter wide road
2.	Mr. Vinod Gonour Mahto & Mrs. Shantidevi Vinod Mahto (Borrower)	28/04/2022 Rs. 10,80,770.98 plus interest other charges	Residential property bearing R.S.No.6/A, Block No.7/B, Plot no.55, Vrundavan Park Near Tundi Branch, Post Office off. Tundi Ena Palsana Road Tundi, Tal.Palsana, Surat - 394310 Gujarat. Bounded : On the North : Plot 54, On the South : Plot 56, On the East : Society Road, On the West : Plot No.80.
3.	Mr. Ambika Makhanlal Jaiswal & Mrs. Radhika Ambika Jaiswal (Borrower)	21/03/2022 Rs. 10,31,756/- plus interest other charges	Residential property bearing Survey No.6/A, Block No.7/B, Plot no.47, Vrundavan Park Near Tundi Branch, Post Office off. Tundi Ena Palsana Road Tundi, Tal.Palsana, Surat - 395006. Bounded : On the North : Plot 48, On the South : Plot 46, On the East : Plot No.28, On the West : Society Road

Date : **02-08-2022** | Place: **Surat** Authorised Officer, Bank of Baroda

EXH.52
REGD.A/D/DASTI/AFFIXATION/BEAT OF DRUM & PUBLICATION/NOTICE BOARD OF DRT SALE PROCLAMATION
OFFICE OF THE RECOVERY OFFICER-I DEBTS RECOVERY TRIBUNAL-II, MUMBAI
 MTNL Bhavan, 3rd Floor, Colaba Market, Colaba, Mumbai.
R.P. No.458/2017 DATED: 07.07.2022
PROCLAMATION OF SALE UNDER RULES 38, 52(2) OF SECOND SCHEDULE TO THE INCOME TAX ACT, 1961 READ WITH THE RECOVERY OF DEBTS AND BANKRUPTCY ACT, 1993.
State Bank of India, Kandivali (W) Br] ... Certificate Holders
M/s. Rudraksha Textiles Pvt Ltd] ... Certificate Debtors
CD-1: M/s. Rudraksha Textiles Private Limited, 101, Parimal Park, Near Shapae UP Club, Tadwadi, Rander Road, Surat, Distt: Surat, Gujarat, Pin 395 009, And Corporate Office : 66/67, Krishna Niwas Building, 5th Floor, Near Edward Cinema, 15 Bomanji Master Road, Kalandavei Road, Marine Lines, Mumbai 400 002 And Factory at D-27, MIDC, Navapur Industrial Area, Vill: Kothade, Tal: Navapur, Distt: Nandurbar, Maharashtra, And : At 128, Sanghvi Tower 2, New Shakuntala Apartments, Adajan Road, Surat 395 009, Gujarat
 Whereas Hon'ble Presiding Officer, Debts Recovery Tribunal No. II Mumbai has drawn up the Recovery Certificate in Original Application No **439/2017** for recovery of **Rs. 82,29,612.76** with interest and cost from the Certificate Debtors and a sum of **Rs. 2,22,42,850** is recoverable together with further interest and charges as per the Recovery Certificate / Decree.
 And whereas the undersigned has ordered the sale of property mentioned in the Schedule below in satisfaction of the said certificate.
 And whereas a sum of **Rs. 82,29,612.76** along with pendent-lite and further interest @ 12% p.a. from the date of filing of application till payment and/or realization from CDs.
 Notice is hereby given that in absence of any order of postponement, the said property shall be sold on **09.08.2022** between **02:00 PM** to **03:00 PM**, (with auto extension clause in case of bid in last 5 minutes before closing, is required) by e-auction and bidding shall take place through "On line Electronic Bidding" through the website of M/s C-1 India Pvt. Ltd, Plot No. 031, Udyog Vihar, Phase 2, gulf Petrochem Building, building no.301 Gurgaon Haryana, PIN: 122015, Help Line No. +91-124-4302020/21/22/23/24. Contact Person: (j)Mr Hareesh Gowda Mobile: +91 9594597555 Email:-hareesh.gowda@c1india.com
 For further details contact: Mr. Vinod Raghunath Rao Sawkadkar, Chief Manager, Mob: 9819246696

The sale will be of the property of the defendant above named as mentioned in the schedule below and the liabilities and claims attaching to the said property, so far as they have been ascertained, are those specified in the schedule against each lot. The property will be put up for the sale in the lots specified in the schedule. If the amount to be realized is satisfied by the sale of a portion of the property, the sale shall be immediately stopped with respect to the remainder. The sale also be stopped if, before any lot is knocked down, the arrears mentioned in the said certificate, interest costs (including cost of the sale) are tendered to the officer conducting the sale or proof is given to his satisfaction that the amount of such certificate, interest and costs have been paid to the undersigned.
 No officer or other person, having any duty to perform in connection with sale, either directly or indirectly bid for, acquire or attempt to acquire any interest in the property sold. The sale shall be subject to the conditions prescribed in Second Schedule of the Income Tax Act, 1961 and the rules made there under and to the further following conditions.
 The particulars specified in the annexed schedule have been stated to the best of the information of the undersigned, but the undersigned shall not be answerable for any error, mis-statement or omission in this proclamation.

- The reserve price below which the property shall not be sold is **Rs. 34,00,000/-(Rupees Thirty Four Lakhs only)**
- The amount by which the bid is to be increased shall be **Rs. 50,000/- (Rupees Fifty thousand only)**. In the event of any dispute arising as to the amount of bid, or as to the bidder, the lot shall at once be again put up to auction.
- The highest bidder shall be declared to be the purchaser of any lot. It shall be in the discretion of the undersigned to decline/acceptance of the highest bid when the price offered appears so clearly inadequate as to make it inadvisable to do so.
- The public at large is hereby invited to bid in the said E-Auction. The offers in a sealed envelope along with demand draft / pay order of any Nationalized Bank / Scheduled Bank along with EMD Amount **Rs.3,40,000/- (Rupees Three Lakhs Forty Thousand only)**, should be deposited with the undersigned not later than by **4.30 p.m. on 06.09.2022**. The demand draft / pay order should be drawn in favour of the "Recovery Officer, DRT-II, Mumbai in R.P. No. 458 of 2017. The above amount/demand draft/pay order shall be refunded to the unsuccessful bidders after due verification / submission of KYC documents. Attested photocopy of TAN/PAN card, Address Proof, Demand Draft / Pay Order shall be uploaded with the online offer. The last date for submission of online offers alongwith EMD and the other information/ details is **06.09.2022** by 4.30 p.m. The Physical inspection of the properties may be taken between 10.00 a.m. and 5.00 p.m. w.e.f. **02.09.2022** at the property site.
- The copy of PAN card, Address proof and identity proof, E-mail ID, Mobile No, and declaration if they are bidding on their own behalf or on behalf of their principals. In the latter case, they shall be required to deposit their authority and in default their bids shall be rejected. In case of the company copy of resolution passed by the board members of the company or any other document confirming representation/attorney of the company and the receipt/counter foil of such deposit should reach to the said service provider or CH Bank by e-mail or otherwise by the said date and hard copy shall be submitted before the Recovery Officer-II, DRT-II, Mumbai on **06.09.2022 upto 4.30 p.m.** In case of failure, bid shall not be considered.
- The successful bidder shall have to deposit **25% of his final bid amount** after adjustment of EMD by next bank working day i.e. by **4.30 P.M.** in the form of **demand draft / pay order** in favour of the "Recovery Officer, DRT-II, Mumbai in R.P. No. 458 of 2017 or directly by way of RTGS/NEFT in the Account No. 30043253890 with State Bank of India, Fort Market Branch, Mumbai, IFSC Code No: SBIN0005347 of Recovery Officer, DRT-II, at Mumbai.
- Once the bid is submitted it is mandatory for the bidder(s) to participate in the bidding process of the e-auction by logging in on the e-auction agency portal, failing which the EMD shall be forfeited to the Government, if the undersigned thinks fit.
- The purchaser shall deposit the balance **75% of final bid amount** on or before **15th day** from the date of sale of the property. If the **15th day is Sunday or other Holiday**, then on the first bank working day after the 15th day by prescribed mode as stated in para 6 above. In addition to the above, the purchaser shall also deposit **pondage fee with Recovery Officer-II, DRT-II @ 2% upto Rs.1,000/- and @ 1% of the excess of said amount of Rs.1,000/-through DD in favour of Registrar, DRT-II, Mumbai.** In case of default of payment within the prescribed period, the deposit, after defraying the expenses of the sale, may, if the undersigned thinks fit, be forfeited to the Government and the defaulting purchaser shall forfeit all claims to the property or the amount deposited. The property shall be resold, after the issue of fresh proclamation of sale. Further the purchaser shall also be liable to make good of any shortfall or difference between his final bid amount and the price for which it is subsequently sold.
 The property is being sold on "AS IS WHERE IS BASIS" AND "AS IS WHAT IS BASIS".
 The undersigned reserves the right to accept or reject any or all bids if found unreasonable or postpone the auction at any time without assigning any reason.

No. of Lots	Description of the property to be sold with the names of the co-owners where the property belongs to defaulter and any other person as co-owners.	Revenue assessed upon the property of any part thereof	Details of any other encumbrance upon the property to which particulars bearing on its nature and value	Claims, if any, which have been put forward to the property and any other known particulars bearing on its nature and value
1	Plot/Factory D-27, Consisting of Land ading 923 Sq.Mtrs., Navapur Industrial Area, Vill: Kothade, Tal. : Navapur, Distt: Nandurbar	Not Available	Mortgaged Property	Not Available

Given under my hand and seal on this 7th day of July, 2022.
 Sd/-
 S. K Sharma
 Recovery Officer
 DRT-II, Mumbai

Bandhan Bank Regional Office: Netaji Marg, Nr. Mithakhali Six Roads, Ellisbridge, Ahmedabad-6. Phone: +91-79-26421671-75

SYMBOLIC POSSESSION NOTICE

NOTICE is hereby given under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under Section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002, the Authorized Officer issued demand notice to the borrower(s) on the date mentioned against the account stated hereinafter calling upon them to repay the amount within 60 days from the date of receipt of said notice. The borrower(s) having failed to repay the amount, notice is hereby given to the public in general and in particular the borrower(s) that the undersigned has taken the symbolic possession of the property described herein below under Section 13(4) of the said Act read with Rule 8 of the said Rules on the date mentioned against the account. The borrower(s) in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealing with the property will be subject to the charge of the Bank for the amounts, interest, costs and charges thereon. The borrowers'/mortgagors' attention is invited to the provisions of sub-section (8) of Section 13 of the Act, in respect of time available, to redeem the secured assets.

Name of borrower(s), Loan Account No	Description of the property mortgaged (Secured Asset)	Date of Demand Notice	Date of Symbolic Possession Notice	O/s Amount as on date of Demand Notice
Mr. Maheshbhai Narpathbai Kanchila Mrs. Shalini Mahesh Kanchila 114/79	All that piece and parcel of the immovable property situated at Survey No. 24 Paiki City Survey No. 6868 Paiki B/243, Lami Park, Near Jivandip Society, Hadka Mil Road, At Dahod, Taluka Dahod, Dist Dahod, Gujarat-389151 and bounded by: North: Boundary of Unit No. B/242, East: Boundary of R.S. No. 24 Paiki Land, West: Boundary of Road, South: Boundary of Unit No. B/244	30.04.2022	04.08.2022	Rs. 14,34,946.53
Mrs. Meetaben Mangilal Kaushal Mr. Mangilal Jagannath Kaushal Mr. Dhimantkumar Mangilal Kaushal 114/256	All that piece and parcel of the immovable property situated at Survey No. 23 Paiki, City Survey No. 6842, Final Plot No. 73 Paiki North to South side, Block No. D, Akashganga Society, B/h Jivandip Society Laxmi Park Road, At Dahod, Taluka Dahod, Dist Dahod, Gujarat 389151 and bounded by: North: Boundary of Block No. C, East: Boundary of Plot No. 74, West: Boundary of Road, South: Boundary of Plot No. 80	30.04.2022	04.08.2022	Rs. 10,27,062.45

Place: Dahod
 Date: 06/08/2022

Authorized Officer
 Bandhan Bank Limited

